

# S.D.ARTS & B.R.COMMERCE COLLEGE,MANSA

UGBA SEM-III [Gujarati] core Paper-203

MCQ-Prepared By Assi. Prof. Hemlataben B. Mehta

પ્રશ્નોનો અને તેનાં જવાબ

૧. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કેન્દ્રમાં શું જોવા મળે છે? - ધર્મ
૨. નરસિંહ પૂર્વેના સૈકાઓ સુધીમાં ગુજરાતી ભાષાને કોણે પ્રચલિત કરી હતી? - જૈન મુનિઓએ ૩. મધ્યકાલીન પદ્યસાહિત્યમાં મુખ્યત્વે કયો રસ જોવા મળે છે? - શૃંગાર
૪. 'સિદ્ધ-હૈમ' ના રચયિતાનું નામ જણાવો. - હેમચંદ્રાચાર્ય
૫. 'જૈનેતર પદ્યવાર્તામાં જૂનામાં જૂની કૃતિનું નામ આપો. - હંસાઉલીદ.રોજ સવારે જૈનો જે પદ્ય ગાતા હતા તે શું કહેવાતા હતા? - સજજાય
૭. મધ્યકાલીન ગુજરાતી કવિતાનાં મુખ્ય કેટલા પ્રવાહો છે? - ત્રણ
૮. નરસિંહપૂર્વેના યુગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? - પ્રાગનરસિંહયુગ/ હેમચુગ
૯. આખ્યાનનાં પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? - ભાલણ
૧૦. અસાઇતનું નામ ગુજરાતના શાની સાથે હંમેશને માટે જોડાઇ ગયું? - લોકનાટ્ય
૧૧. 'ભરતેશ્વર-બાહુબલિરાસ' નાં રચયિતાનું નામ જણાવો. - શાલિભદ્રસૂરિ
૧૨. નેમિનાથ ફાગુ નાં કર્તાનું નામ જણાવો. - રાજશેખર
૧૩. 'વસંતવિલાસ' કૃતિના રચયિતાનું નામ જણાવો. - અજ્ઞાત કવિ
૧૪. નરસિંહપૂર્વેના કયા કવિઓએ 'રાસા' લખ્યા છે? - જૈનેતર
૧૫. મધ્યકાલીન સાહિત્ય મુખ્યત્વે શેમા રચાયું છે? - પદ્ય
૧૬. મધ્યકાલીન ગુજરાતી ભાષાની પહેલી ગદ્યકૃતિનું નામ જણાવો. - પૃથ્વીચંદ્રચરિત
૧૭. મધ્યકાલીન ગુજરાતી ભાષામાં પહેલું બ્યારમાસીકાવ્ય કયું મનાય છે? - નેમિનાથ ચતુષ્પદિકા'
૧૮. મધ્યકાલીન ગુજરાતી ભાષામાં પહેલી લોકવાર્તા કઈ છે? - 'હંસરાજ -વચ્છરાજ ચઉપદ'
૧૯. 'સ્થૂલિભદ્ર ફાગુ' માં કોના જીવન પરિવર્તનની કથા જોવા મળે છે? - કોશા
૨૦. જયશેખરસૂરિ કૃત 'ત્રિભુવનદીપકપ્રબંધ' કઈ કૃતિ પર આધારિત છે? - 'પ્રબોધ ચિંતામણિ'
૨૧. મધ્યકાલીન ગુજરાતી ભાષાનું પ્રથમ વ્યાકરણ કયું છે? - 'સિદ્ધ-હૈમ'
૨૨. શ્રીધર વ્યાસ રચિત 'રણમલ્લહંદ'કયા સ્વરૂપની કૃતિ છે? - પ્રબંધ
૨૩. આજે પણ નરસિંહના શું જાણીતાં છે? - પ્રભાતિયાં
૨૪. નરસિંહ મહેતાનો પ્રિય પદ્યપ્રકાર કયો છે? - પદ્ય
૨૫. નરસિંહ મહેતાનું મૂળ વતન કયું હતું? - જૂનાગઢ
૨૬. 'શામળશાનો વિવાહ' કૃતિના રચયિતાનું નામ જણાવો. - નરસિંહ મહેતા
૨૭. 'જાગીને જોઉં તો જગત દીસે નહીં' પંક્તિનાં કર્તાનું નામ જણાવો. - નરસિંહ મહેતા
૨૮. 'ઘડપણ કોણે મોકલ્યું' રચનાના કર્તાનું નામ જણાવો - નરસિંહ મહેતા
૨૯. નરસિંહ મહેતાના યાતુરીના પદો પર જયદેવની કઈ કૃતિની અસર છે? - 'ગીતગોવિંદ'
૩૦. મીરાંબાઇની કઈ રચનાઓ જાણીતી છે? - પદ્ય
૩૧. મીરાંબાઇના પતિનું નામ જણાવો. - ભોજરાજા
૩૨. મીરાંબાઇની કવિતાનો મુખ્ય વિષય કયો હતો? - શ્રીકૃષ્ણલીલા
૩૩. 'મુખડાની માયા લાગી રે મોહન પ્યારા' - આ પદ્યનાં રચયિતાનું નામ લખો. - મીરાંબાઇ
૩૪. મીરાંને કયા ગુરુ તરફથી 'મીરાં' ઉપનામ મળ્યાનું કહેવાય છે? - ગુરુરૈદાસ
૩૫. મીરાંના 'ગોવિંદો પ્રાણ અમારો' પદ્યનો પ્રકાર જણાવો. - આત્મચરિત્રાત્મક
૩૬. ભાલણ કયાંના વતની હતા? - પાટણના
૩૭. કવિ ભાલણે બાણની સંસ્કૃતમાં લખાયેલી કઈ કૃતિનો અનુવાદ આપ્યો? - કાદંબરી
૩૮. 'રામવિવાહ આખ્યાન' ના કવિનું નામ જણાવો. - ભાલણ
૩૯. આખ્યાનને કડવાબધ સ્વરૂપ કયા કવિએ આપ્યું હતું? - ભાલણે
૪૦. ભાલણના 'મૃગીઆખ્યાન'નું કથાવસ્તુ શેના પર આધારિત છે? - 'શિવપુરાણ'
૪૧. ભાલણની કોઈ પણ બે કૃતિઓના નામ આપો. - 'શિવભીલડીસંવાદ', 'મૃગીઆખ્યાન'
૪૨. ભોજા ભગતે ચાબખાઓમાં કોના પર પ્રહાર કર્યા છે? - પાખંડીઓ
૪૩. વલ્લભ મેવાડાનાં શું પ્રખ્યાત છે? - ગરબા
૪૪. 'ફાગુ' કઈ ઋતુમાં ગાવાનો કાવ્ય પ્રકાર છે? - વસંતઋતુ
૪૫. રાસાનો આરંભ કોની સ્તુતિથી થતો હતો? - ગણપતિની
૪૬. ધીરાને વધારે ફાવટ શેમાં હતી? - પદ્ય
૪૭. કાફી કોના દ્વારા પ્રસિધ્ધ છે? - ધીરા ભગત
૪૮. ગરબા સાહિત્યનો પ્રારંભ કયા કવિએ કર્યો હતો? - વલ્લભ મેવાડા
૪૯. જયશેખરસૂરિએ કયું રૂપક કાવ્ય રચ્યું છે? - 'ત્રિભુવનદીપકપ્રબંધ'
૫૦. ફાગુના આરંભમાં કોની સ્તુતિ કરવામાં આવતી હતી? - નેમિનાથની

